

# ધૂળેટી ઉજવો AI સંગ: ફોટોમાં ઉમેરો નવા રંગ!

**AI** ટૂલ ગૂગલ જેમિનાઈ દિવસે દિવસે વધારે યુઝર ફેન્ડલી બનતું જાય છે. કારણ કે ગૂગલ પાસે પહેલાથી બધી ભાષાઓનો ડેટા બેઝ હતો. એને સમજીને ગૂગલ હવે નવું નવું આપે છે ને બીજા AI ટૂલને સ્પર્ધા પુરી પાડે છે. ગૂગલ કંપની હવે નવી સુવિધા સાથે યુઝર્સ સામે આવી છે. અથવા એમ કહો કે નવી સુવિધા ઉમેરી છે. નેનો બનાના-2ના કારણે હવે ફોટો એડિટિંગ ખૂબ સરળ બન્યું છે.

હોળી ધૂળેટીના પોસ્ટર્સ બનાવવા હોય કે શુભકામના પાઠવતી ઈમેજ બનાવવી હોય તો એ કામ હવે એક મિનિટમાં થઈ શકે છે. હજુ ગયા વર્ષ સુધી આવા પોસ્ટર્સ બનાવવા માટે ફોટો એડિટિંગ એપ્સનો ઉપયોગ કરવો પડતો હતો અને એક ફોટો બનાવવો હોય તો એમાં મિનિટો લાગી જતી. છતાંય એમાં પ્રોફેશનલ ટય તો ન જ આવે. અણઘડ રીતે એડિટિંગ થયું છે એ પહેલી નજરે દેખાઈ આવે. પરંતુ હવે પ્રોફેશનલ લૂક આપતું એડિટિંગ આસાન બની ગયું છે.



ગૂગલે હોળી-ધૂળેટીના તહેવાર પહેલાં ફોટો એડિટિંગ 3 ટૂલ નેનો બનાના-2 લોન્ચ કરી દીધું છે ને એની મદદથી એક મિનિટથી પણ ઓછા સમયમાં તમે તમારા ફોટોમાં હોળી-ધૂળેટીની થીમ પર એડિટિંગ કરી શકો છો, પોસ્ટર્સ બનાવી શકો છો. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગયા સપ્તાહે જ જાહેરાત કરતા કહ્યું: બેસ્ટ ઈમેજ મોડલ નેનો બનાના-2 લોન્ચ થઈ ચૂક્યું છે. ફોટોને વધુ વાસ્તવિક રાખીને આ નવું ટૂલ હાઈ રિજોલ્યુશન રિઝલ્ટ આપશે અને જરૂરી સુધારા પણ કરી આપશે.

તેમના કહેવા પ્રમાણે જ આ નવું મોડલ જૂના-લો રિજોલ્યુશનના ફોટોને હાઈ રિજોલ્યુશનમાં ફેરવી શકે છે. નેનો બનાના-2 મોડલનું આ સૌથી મોટું કામ છે. વળી, યુઝર્સના ફોટોમાં થીમ પ્રમાણે ફેરફાર, વાસ્તવિક લાગે એ રીતે કરી આપે છે. તમે હોળીની થીમ પ્રમાણે ફોટો બનાવવા ઈચ્છો તો તમારે જેમિનાઈમાં જઈને જે ચેટબોક્સ ખુલે એમાં ફોટો અપલોડ કરવાનો રહેશે. એ પછી સિમ્પલ પ્રોમ્ટ આપવાના છે - ઉદાહરણ: મોં વાસ્તવિક રાખીને બેકગ્રાઉન્ડ હોળીને અનુરૂપ કરી આપો. ફોટો ઠકે સાઈઝમાં રાખશો. આ સિવાય કોઈ વધારે સૂચનો હોય તો એ પણ કરી શકાશે પછી તમે રન કરી દેશો તો થોડી સેકન્ડોમાં પરિણામ મળી જશે. તમને આશ્ચર્ય થશે કે રિઝલ્ટ કોઈ સારા ડિઝાઈનરને ટક્કર આપે એવું હોય છે.

પ્રોમ્ટ આપવામાં ખાસિયત એ ઉમેરાઈ છે કે આપણે આપણી ભાષામાં લખીએ તો પણ પરિણામ સારું આવે છે. ગૂગલમાં ભાષાઓ ઘણી અપડેટ થઈ ચૂકી છે એટલે બધી માન્ય ભાષાઓમાં રિઝલ્ટ મળે છે. અત્યાર સુધી અંગ્રેજીમાં પ્રોમ્ટ આપવાથી રિઝલ્ટ વધારે સારું મળતું હતું, કારણ કે AI મોડલ્સ અંગ્રેજીના કમાન્ડને વધારે સારી રીતે રિએક્ટ કરતું હતું, પરંતુ નવા AI મોડલ્સમાં અન્ય ભાષાઓનો ડેટાબેઝ પણ મજબૂત થયો છે એટલે હવે સ્થાનિક ભાષાઓમાં પરિણામ અસરકારક મળે છે.



**હોળી ધૂળેટીના પોસ્ટર્સ બનાવવા હોય કે શુભકામના પાઠવતી ઈમેજ બનાવવી હોય તો એ કામ હવે એક ક્લિકમાં, એક મિનિટમાં થઈ શકે છે**

નેનો બનાના-2 મોડલ જૂના ફોટોને હાઈ રિજોલ્યુશન બનાવવા માટે બેહદ ઉપયોગી થવાનું છે. અત્યાર સુધી ખૂબ જ લાંબી પ્રોસેસ પછી લો રિજોલ્યુશનની ઈમેજને હાઈ રિજોલ્યુશનમાં ફેરવી શકાતી હતી, પરંતુ હવે આ કામ ક્લિકવગું થઈ ગયું છે. તમે નોનો બનાના-2ને કમાન્ડ આપશો કે - જૂના ફોટોમાં ખૂબ જ વાસ્તવિક ચહેરા રાખીને ફોટોની ક્વોલિટી હાઈ કરી આપો - તો એ કામ કરી

આપે છે. વાસ્તવિક લૂક સાથેના ફોટો બનાવવાની સાથે સાથે જુદી જુદી થીમ પ્રમાણે ફની લૂકની AI ઈમેજ બનાવવી હશે કે ફોટોમાંથી હોળી-ધૂળેટીના કાર્ટૂનિસ્ટ-ચિત્રો સ્ટાઈલની ઈમેજ બનાવવી હશે તો એ પણ સરળતાથી બની જશે. તમે ઉતાવળમાં ફોટો પડ્યો હોય ને બેકગ્રાઉન્ડ બરાબર આવ્યું નહીં હોય તો એ કામ AI કરી આપશે. તમને એમાં રંગો ઉમેરવા હશે ને AIને કહેશો તો એ તમને કહેશે - થઈ જશે. તે એટલે સુધી કે તમારે તદ્દન નવી ઈમેજ આપીને એને ધૂળેટીના રંગે રંગવી હશે તો એ પણ થઈ જશે.

તો હવે તમે ધૂળેટીના દિવસે સોશિયલ મીડિયામાં ફોટો મૂકવા માટે AIનો ઉપયોગ કરશોને? •

## દૂસરો પર અગર તબ્સિરા કીજિયે સામને આઈના રખ લિયા કીજિયે

- ખુમાર બારાબંકવી

**બી** જાની જયાટે સમીક્ષા કરો, સામે દર્પણ મૂક્યા કરો. બીજાની જયાટે ટીકા કરો કે સમીક્ષા (તબ્સિરા) કરો ત્યારે પોતાનું પણ અવલોકન કરી લેવું જોઈએ. બીજાના ગુણદોષ દર્શાવો ત્યારે પોતાના ગુણદોષ વિશે પણ એક નજર નાંખી લેવી જોઈએ. આઈના સામે પોતાની જાતનું પણ આપણે મૂલ્યાંકન કરી લેવું જોઈએ કારણ કે અરીસામાં માત્ર ચહેરો નહીં માણસનું ચરિત્ર પણ સ્પષ્ટ જોઈ શકાય છે. દર્પણ સામે તમારો ચહેરો આવે એટલે તમારી જાત સાથે સંવાદ કરવાની તક મળે. અહીં કોઈ બુકાની તમારા ચહેરાને સંતાડી નહીં શકે. જાત સાથેનો સંવાદ કરો ત્યારે તમને જાણ થાય કે તમે બીજાની ટીકા કરો છો, બીજાના ગુણદોષની ચર્ચા કરો છો પરંતુ તમારી જાતને તમારા સિવાય બીજું કોઈ કેટલું જાણે છે? તમારા વિશે તમારાથી વધુ સારી સમીક્ષા કોણ કરી શકે? બીજાના સર્જન વિશે, બીજાના કાર્ય વિશે સમીક્ષા કરો ત્યારે જરા પોતાની તરફ પણ જોઈ લેવું જોઈએ. જો તમે પોતાની સમીક્ષા વિશે સભાન હશો તો બીજાની સમીક્ષા બરોબર કરી શકશો. બીજાની ટીકા કે તેની આલોચના કરવામાં પોતાની તરફ પણ જોઈ લેવું જોઈએ. તમારી પોતાની આલોચનાને પણ સહન કરવાની તમારે તૈયારી રાખવી પડે. તમારા કાર્યની કોઈ ટીકા કરે તો પોતાના કાર્યનું ફરીથી અવલોકન કરવાની તૈયારી પણ રાખવી પડે. તમે કોઈની આલોચના સહન કરી શકો તો જ તમે બીજાની આલોચના કરવા માટે લાયક છો. તમારા કાર્ય વિશે કે તમારા કોઈ સર્જન વિશે જો કોઈ આલોચના સહન નહીં કરી શકો તો બીજાની આલોચના કરવાનો તમને કોઈ અધિકાર નથી. પોતાના ગુણદોષ જાણવા દર્પણ સામે પોતાની જાતને રાખતા શીખવું જોઈએ. હંમેશાં બીજાની ટીકા કરતા રહેતા લોકો પોતાના વિશે કેટલા સભાન છે? પોતાના વિશે જેટલી ટીકા સહન થઈ શકે તેટલી જ આલોચના બીજાની કરો. જાત સાથે સંવાદ કરવા દર્પણ સામે જાતને મૂકી બુચો અહીં તમારી સચોટ સમીક્ષા થશે. •

## કેફિયત

★ દનીફ મહેરી

